

India, US agree to a trade deal;

reciprocal tariff reduced to 18%: Trump

US President Donald Trump on Monday announced his country's much-awaited trade deal with India, reducing the reciprocal tariff on Indian goods to 18 per cent from 25 per cent. The announcement by Trump on Truth Social came after a phone call with Prime Minister Narendra Modi. Shortly after, Modi thanked Trump "on behalf of the 1.4 billion people of India for this wonderful announcement".

The agreement came more than five months after Washington imposed 50 per cent tariffs on several Indian exports, including a 25 per cent punitive duty for India's purchase of Russian crude oil.

Trump said New Delhi had agreed to stop buying Russian oil and buy much more from the US and, potentially, Venezuela, which would help end the war between Russia and Ukraine. He said India would "likewise" move forward to reduce its tariffs and non-tariff barriers against the US to "ZERO".

"It was an honour to speak with Prime Minister Modi, of India, this morning. He is one of my greatest friends, a powerful and respected leader of his country... He agreed to stop buying Russian oil, and to buy much more from the United States and, potentially, Venezuela...", Trump said in his post.

"Out of friendship and respect for Prime Minister Modi and, as per his request, effective

immediately, we agreed to a Trade Deal between the United States and India, whereby the United States will charge a reduced Reciprocal Tariff, lowering it from 25% to 18%," he further said.

According to Trump, Modi has also committed to 'buy American' at a much higher level, in addition to over \$500 billion of US energy, technology, agricultural, coal, and many other products.

"Our amazing relationship with India will be even stronger going forward. Prime Minister Modi and I are two people that GET THINGS DONE, something that cannot be said for most. Thank you for your attention to this matter!" he said in the post.

In his post on X, Modi said: "Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement."

The prime minister said when two large economies and the world's largest democracies work together, it "benefits our people and unlocks immense opportunities for mutually beneficial cooperation".

"President Trump's leadership is vital for global peace, stability, and prosperity. India fully supports his efforts

for peace. I look forward to working closely with him to take our partnership to unprecedented heights," he added.

India and the US have been working on two broad trade deal frameworks – an early harvest deal and a larger framework or Bilateral Trade Agreement (BTA), which will take longer time to materialise. The near-term focus is on the early harvest deal, which can address the reciprocal tariff is also taking shape.

India-US BTA negotiations were launched in March and have so far included half a dozen rounds of talks. The last recent informal discussions took place in New Delhi during the visit of a trade team headed by the deputy US Trade Representative (USTR) in December. Thereafter, the discussions were on a pause due to the year-end holiday season, amid the missed 'Fall' deadline and uncertainty regarding the finalisation of the deal. Thereafter, both sides were currently virtually engaged.

The India-US trade deal has gone through ups and downs like a roller coaster. While the devil is in the details, it removes a hanging sword over the rupee, equity and bond markets. Let us hope it is a win-win deal for both countries, as they have a lot to gain through cooperation, said Nilesh Shah, managing director, Kotak Mahindra AMC.

Govt likely to consider merger of state-run financiers PFC and REC

The Centre is likely to consider a merger of state-run power-sector lender Power Finance Corporation (PFC) and its subsidiary REC as part of the restructuring push, according to sources.

"A road map for that (the merger) will be soon announced. A decision is expected shortly although procedural steps need to be completed. After that, the proposal will go to the Cabinet for approval. One of the two names will be retained, and no third entity will be created," said the source.

The merger is aimed at achieving synergy between the two organisations, according to the source.

REC, formerly Rural Electrification Corporation, was originally mandated, as its earlier name suggests, to focus on rural electrification, but its role has since evolved and now overlaps significantly with PFC's. "Given this convergence, the government is considering a single identity for both entities," added the source.

In her Budget speech on Sunday, Finance Minister Nirmala Sitharaman proposed restructuring REC and PFC as part of the government's strengthening of public-sector financial institutions. The government holds a 56 per cent stake in PFC, which owns 52.63 per cent in REC.

"Modalities for this have to be worked out by the power ministry, which is the administrative ministry for both," the source added.

In March 2019, PFC completed the acquisition of a majority stake in REC by transferring Rs.14,500 crore to the government and was hopeful of the merger of the two firms in 2019-20, which fell through. PFC acquired the government's 1,039.4 million shares, constituting 52.63 per cent, in REC, along with management control. The acquisition price was worked out to Rs.139.50 per share. This stake acquisition came following in-principle approval from the Cabinet Committee on Economic Affairs.

Both PFC and REC are Navratna central public-sector enterprises, and this acquisition was a step towards consolidating companies operating in the same space.

PFC shares on Monday on the BSE closed higher by 1.13 per cent at Rs.385.60 while REC gained 1.23 per cent to settle at Rs.363.10. In the second quarter of 2025-26 (Q2FY26), PFC had reported standalone loan asset books of Rs.5.6 trillion, with the renewable-energy loan books growing 32 per cent year-on-year at Rs.84,680 crore. REC's loan books were at Rs.5.82 trillion in Q2.

"Consolidation will indicate that the entities would be merged. Hence, under a merger process, the minority shareholders of REC would get equity shares of PFC in accordance with the pricing norms decided by the valuers," said a senior analyst. He added that merging two entities of this

Hyundai Motor India Q3FY26 net profit increases 6.3% to Rs.1,234 crore

Hyundai Motor India Limited's (HMITL's) consolidated net profit rose by 6.3 per cent year-on-year (Y-o-Y) to ₹1,234 crore in the third quarter of 2025-26 (Q3FY26), aided by improved demand following goods and services tax (GST) rate rationalisation in September.

Tarun Garg, managing director and chief executive officer (MD&CEO) of HMITL, said during a video press conference that automobile demand in India benefited from multiple policy measures, including income tax cuts announced in the previous Union Budget, GST rate cuts implemented in September, and cumulative interest rate reductions by the Reserve Bank of India (RBI) during 2025.

Garg said while growth was visible across segments after the GST rate cuts, industry sales data indicated a continued

consumer preference for compact sport utility vehicles (SUVs). He pointed out that hatchbacks accounted for 22.4 per cent of industry sales between January and August, but their share declined to 21.4

including higher costs linked to the stabilisation of the company's Pune facility, which became operational from October 1. He said processing costs increased during the initial phase of rampup at the plant.



per cent between September and December. On the other hand, the share of compact SUVs increased from 22.1 per cent to 23 per cent over the same period.

K S Hariharan, head of investor relations, HMITL, said this sequential decline in margins during the quarter was driven by multiple factors,

However, Hariharan said some of these headwinds were partly offset by moderation in domestic discounts compared with the previous quarter.

HMITL's exports dropped from 51,400 units in Q2FY26 to 48,888 units in Q3FY26. However, on a Y-o-Y basis, the company's exports recorded a growth of 21.1 per cent.

Centre can pursue \$3.8 bn arbitral award against Reliance Industries

The Centre can pursue its appeal against the decision of a single-judge Bench of the Delhi High Court, which refused to enforce a \$3.8 billion foreign arbitral award against Reliance Industries over the Panna-Mukta and Tapti oil and gas fields, the court ruled on Monday.

A Division Bench of Justice Navin Chawla and Justice Madhu Jain ruled that the single judge's decision dismissing the Union of India's enforcement petition amounted to a refusal under Section 48 of the Arbitration and Conciliation Act, 1996, making it "appealable" under Section 50 of the Act.

Section 48 governs the conditions under which Indian courts may refuse to enforce foreign arbitral awards, and Section 50 governs appealable

orders regarding foreign awards.

The appeal arises from a long-running dispute between the Centre and RIL over production-sharing contracts (PSCs) for the Panna-Mukta and Tapti oil and gas fields.

The Centre had sought to enforce a 2016 final partial award (FPA) of an international arbitral tribunal, claiming that RIL owed it around \$3.85 billion on account of excess cost recovery.

In July 2023, a single judge of the Delhi High Court dismissed the enforcement petition, holding that the 2016 award was purely declaratory and inchoate, and could not be executed as a money decree since key issues, including the final determination of the cost recovery limit (CRL), were still

pending before the arbitral tribunal.

The judge had also observed that enforcing the award at that stage would violate principles of natural justice and could be refused under the public-policy exception in Section 48.

RIL, represented by senior advocate Harish Salve, had raised a preliminary objection to the Centre's appeal, arguing that the single judge had not "refused enforcement" under Section 48 but had merely held the execution petition to be premature and non-maintainable.

On that basis, RIL contended that no appeal would lie under Section 50, which permits appeals only against orders expressly refusing the enforcement of a foreign award.

Today's Important Weblinks:

- https://chanakyanipothi.com/
- https://chanakyanipothi.com/grey-market-premium-latest-ipo-gmp/
- https://chanakyanipothi.com/ipo-subscription-status/
- https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/
- https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/
- https://chanakyanipothi.com/upcoming-ipos-2025/
- https://sahifund.com/
- 1) https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/
- 2) https://sahifund.com/latest-new-fund-offers/
- 3) https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/
- 4) https://sahifund.com/icici-prudential-flexicap-fund/
- 5) Sahifund bottom
- https://chanakyanipothi.com/best-stock-to-buy-today/
- https://chanakyanipothi.com/news-crx/
- https://chanakyanipothi.com/fii-data-today/
- https://sahifund.com/fii-dii-buy-sell-activity/
- https://chanakyanipothi.com/chanakya-niti/
- https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/
- https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/
- https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/
- https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/
- https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/
- https://chanakyanipothi.com/whatsapp-group/

Rejecting this argument, the Division Bench held that the refusal to execute the award, after examining its enforceability and invoking Section 48, squarely fell within the statutory framework for appeals. The court noted that the single judge had explicitly relied on Section 48(2)(b), including the public-policy grounds, to deny enforcement.

"The refusal to enforce the 2016 FPA by the learned Single Judge is under Section 48 of the Act, which is appealable under Section 50(1)(b)," the Bench held.

DYNAMIC INDUSTRIES LIMITED							
CIN : L24110GJ1989PLC011989							
Regd Office :Plot No. 5501/2, Phase III, Mr. Trikampura Cross Road, G.I.D.C., Vatva, Ahmedabad - 382 445							
Tel : 25897221-22-23, Fax: 25834292							
Email : accounts@dynamind.com Website : www.dynamind.com							
Statement of Unaudited Financial Result for the Quarter and Nine Months ended on 31st December, 2025							
(Rs. In Lakhs except earning per share)							
Sr. No	PARTICULARS	Quarter Ended 31/12/2025 (Unaudited)	Quarter Ended 30/09/2025 (Unaudited)	Quarter Ended 31/12/2024 (Unaudited)	For Nine Months ended		Year Ended 31/03/2025 (Audited)
					31/12/2025 (Unaudited)	31/12/2024 (Unaudited)	
I	Income:						
[a]	Revenue From Operations	1410.11	1787.50	1,444.35	5425.58	5367.18	7265.30
[b]	Other Income	2.86	21.80	10.42	26.78	29.97	40.66
II	Total Income(a+b)	1412.97	1809.30	1454.77	5452.36	5397.15	7305.96
III	Expenses:						
[a]	Cost of materials consumed	1074.46	1132.56	1113.43	3685.32	3944.95	5099.53
[b]	Purchase of Stock in Trade	15.89	49.24	51.27	205.62	293.57	407.65
[c]	Changes in inventories of finished goods, work in progress and stock in -trade	(84.60)	122.28	(147.90)	72.45	(241.89)	(70.48)
[d]	Employees benefits expenses	91.71	91.75	94.76	275.53	278.10	365.20
[e]	Finance costs	29.25	36.98	39.92	99.82	113.95	153.35
[f]	Depreciation and amortisation expenses	53.05	52.69	51.98	157.63	151.24	202.32
[g]	Other expenses	224.94	270.45	241.32	785.72	720.63	944.24
IV	Total Expenses	1404.70	1755.95	1444.78	5282.09	5260.55	7101.81
V	Profit before exceptional items and tax(II-IV)	8.27	53.35	9.99	170.27	136.60	204.15
	Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00	0.00
VI	Profit before tax (V-VI)	8.27	53.35	9.99	170.27	136.60	204.15
VII	Tax Expenses:						
VIII	Current Tax	(5.23)	14.25	0.00	53.77	8.99	8.99
(a)	Deferred Tax	8.10	3.01	10.11	(3.90)	35.61	36.59
(b)	Tax in respect of earlier years	0.00	0.00	0.00	0.00	0.00	0.00
(c)	Total Tax Expenses	2.87	17.26	10.11	49.87	44.60	45.58
IX	(Loss) / Profit for the Period from Continuing operations (VII-VIII)	5.40	36.09	(0.12)	120.40	92.00	158.57
X	(Loss) / Profit for the Period from Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00	0.00
XI	Tax expenses of Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00	0.00
XII	(Loss) / Profit for the Period from discontinuing operations (after tax) (X-XI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00
XIII	(Loss) / Profit for the Period (IX-XII)	5.40	36.09	(0.12)	120.40	92.00	158.57
XIV	Other Comprehensive Income / (Loss)						
[a]	Items that will not be reclassified to Profit or Loss (Net of Tax)	31.45	(0.35)	(0.31)	31.71	0.47	1.10
[b]	Items that will be reclassified to Profit or Loss (Net of tax)	0.00	0.00	0.00	0.00	0.00	0.00
XV	Total Comprehensive income / (Loss) for the period (XIII+XIV) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	36.85	35.74	(0.43)	152.11	92.47	159.67
XVI	Paid-up equity share capital (face value of Rs.10)	302.85	302.85	302.85	302.85	302.85	302.85
XVII	Reserves/Other Equity						4511.61
XVIII	Earning per equity Shares(For Continuing Operation) (of Rs 10 each) (not annualised)						
[a]	Basic	0.18	1.19	-0.00	3.98	3.04	5.24
[b]	Diluted	0.18	1.19	-0.00	3.98	3.04	5.24
XIX	Earning per equity Shares(For Discontinuing Operation) (of Rs 10 each) (not annualised)						
[a]	Basic	0.00	0.00	0.00	0.00	0.00	0.00
[b]	Diluted	0.00	0.00	0.00	0.00	0.00	0.00
XX	Earning per equity Shares (of Rs 10 each) (not annualised)						
[a]	Basic	0.18	1.19	-0.00	3.98	3.04	5.24
[b]	Diluted	0.18	1.19	-0.00	3.98	3.04	5.24
Notes:							
1.The financial results of the company for the quarter and nine months ended on 31st December, 2025 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 3rd February, 2026. The limited review as required under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended has been completed by the statutory auditors of the Company.							
2.These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and relevant amendments thereafter.							
3.The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under "Dyes and Chemicals" which is considered to be the only reportable business segment.							
4.On November 21, 2025, the Government of India notified four Labour Codes – the Code on Wages, 2019, the Industrial Relations Code, 2020, the Code on Social Security, 2020, and the Occupational Safety, Health and Working Conditions Code, 2020 (collectively referred to as the New Labour Codes) – consolidating 29 existing labour laws, which became effective immediately.							
Following the implementation of the New Labour Codes, the Company has recognized a provision for defined benefit obligations in its financial results for the quarter ended December 31, 2025, based on management's assessment and estimates of liabilities.							
The Company continues to closely monitor the finalization of Central and State Rules, as well as clarifications to be issued by the Government on various aspects of the New Labour Codes. Any additional accounting impact, if required, will be reflected in subsequent financial results in line with such developments.							
5. The Company does not have any subsidiary company including an associate and joint venture. Accordingly, preparation of consolidated financial results is not applicable.							
For and on behalf of Board of Directors, Dynamic Industries Limited							
Sd/-							
Neeraj Shah							
Managing Director							
DIN: 000512261							
Date : 3rd February, 2026							
Place : Ahmedabad							



ધી જ્યુઝલાઇન

વર્ષ : ૩૨ અંક : ૧૩૧ તા.૪-૦૨-૨૦૨૬ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

અમેરિકા અને ભારત વચ્ચેની વ્યાપાર સમજૂતીની જાહેરાત

ડિકેન્સ શેરોમાં લાંબો કસ નથી રહ્યો



ગયા અઠવાડિયાના બે મહત્વના ડેવલપમેન્ટમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર સમજૂતી થઈ અને બીજા ડેવલપમેન્ટમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નથી કરાયો.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે છેલ્લા ૨૦ વર્ષથી વ્યાપાર સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી હતી. વાટાઘાટો શરૂ થાય અને પાછી અટકી પડે અને આ એક રાજકીય રીતે સંવેદનશીલ બાબત બની ગઈ હતી પરંતુ ગયા અઠવાડિયે યુરોપિયન યુનિયનના પ્રેસિડન્ટ ઉરસુલા વાન ડેર લેન

ગામની ગપસપ

- તાતા સ્ટીલ**, છેલ્લા ઘણા સમયથી ભેગા કરાવીએ છીએ અને અત્યારે રૂા. ૧૯૫ના ભાવે આકર્ષક, ગુરુવારે એક તબક્કે રૂા. ૨૦૩નું ટોપ પણ બતાવેલું અને આ શેરમાં રોકાણ જાળવી રખાય. અત્યારના ભાવે થોડાક શેરો ભેગા કરવા ખોટા નહિ. ધીમા સુધારા સાથે ઉપરમાં રૂા. ૨૧૫ અને તે પછી ધીરે ધીરે રૂા. ૨૨૬નો ભાવ જોવા મળવાની ગણતરી.
- કોલ ઇન્ડિયા**, એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં સુધારો, અને સાથે સાથે કોલ ઇન્ડિયા તેની પેટા કંપનીઓના આઈપીઓ લાવીને જંગી વેલ્યુઅનલોકિંગ હાંસલ કરી રહી છે. શેર અત્યારે રૂા. ૪૫૬ ઉપર અને આગામી દિવસોમાં ઊંચું ડિવિડન્ડ આપતી આ કંપનીમાં ધીમા સુધારે રૂા. ૪૭૨ અને તે પછી રૂા. ૪૯૨ના ભાવની સંભાવના મજબૂત છે.
- હિન્ડાલ્કો**, એલ્યુમિનિયમ અને કોપર બંને ધાતુઓમાં અત્યારે જોરદાર તેજી અને ચાંદી પછી હવે ખેલાડીઓનું ફોકસ કોપર ઉપર, હિન્દુસ્તાન કોપરને તો ઊંચકી દીધો અને તેથી હવે રૂા. ૯૬૮વાળા હિન્દાલ્કો ઉપર ખેલાડીઓનું ફોકસ, વેલ્યુએડેડ પ્રોડક્ટોને કારણે નફાશક્તિ ખૂબ જ સુંદર છે અને આગામી દિવસોમાં આ શેરમાં મજબૂત અપટ્રેન્ડ સાથે રૂા. ૧૦૨૪ અને તે પછી રૂા. ૧૦૪૨નો ભાવ જોવા મળવાની ગણતરી.
- એક્સિસ બેંક**, પ્રાઈવેટ સેક્ટર બેંકોમાં અત્યારે શોર્ટટર્મ ખેલાડીઓનું ફોકસ એક્સિસ બેંક ઉપર, ધીરે ધીરે વધીને રૂા. ૧૩૬૧ ઉપર આવ્યો છે અને આગામી દિવસોમાં આ શેરમાં સુંદર રીરેટિંગ સાથે રૂા. ૧૩૮૫ અને તે પછી ધીરે ધીરે રૂા. ૧૪૦૬નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.
- સ્ટેટ બેંક**, પીએસયુ શેરોમાં અત્યારના તબક્કે આ શેર ઉપર ફોકસ વધારવાનું ઘણા સમયથી કહીએ છીએ. અત્યારના રૂા. ૧૦૬૨ના ભાવે શેર ખૂબ જ આકર્ષક, પરિણામો પણ જોરદાર આવવાની તૈયારી, ધીમા સુધારા સાથે રૂા. ૧૦૭૪ અને તે પછી રૂા. ૧૦૮૪નો ભાવ આવી જવાની સંભાવના મજબૂત.
- અલ્ટ્રાટેક સિમેન્ટ**, ડિસેમ્બર મહિનાથી સિમેન્ટ વેચાણ વોલ્યુમોમાં સુંદર સુધારો અને તેનો મોટો લાભ દેશબરમાં પ્લાન્ટ ધરાવતી અલ્ટ્રાટેક સિમેન્ટને મળ્યો છે. કુના ભાવ પણ નીચા હોવાનો ફાયદો મળે, અત્યારના રૂા. ૧૨૬૦૦ના ભાવે થોડાક શેરો લઈને મૂકી શકાય અને ધીમા સુધારા સાથે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં રૂા. ૧૨૭૦૦ અને તે પછી ધીરે ધીરે રૂા. ૧૨૮૦૦નો ભાવ જોવા મળવાની સંભાવના મજબૂત છે.
- ટેક મહિન્દ્રા**, આઈટી શેરોમાં અત્યારે ટેક મહિન્દ્રાના શેર ઉપર ખેલાડીઓનું ફોકસ, રૂા. ૧૭૪૫માં ખોટો નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આવક્રોમાં ૭.૫૨ ટકાનો સુધારો, અત્યારના ભાવે શેર નાના લોટમાં ભેગા કરી શકાય અને ઉપરમાં રીરેટિંગ સાથે રૂા. ૧૭૮૪ અને તે પછી રૂા. ૧૮૦૦ના ભાવની સંભાવના મજબૂત છે.
- ગુઓ ફિનાન્સ**, શેર છેલ્લા થોડા દિવસોથી કરેક્શન અને ઘટાડાના તબક્કામાં. અત્યારે રૂા. ૨૫૩ ઉપર તો આવી ગયો. અને હજી નાના ઘટાડા સાથે આ શેરમાં રૂા. ૨૫૦ આસપાસ ટ્રેન્ડ બદલાવાની ગણતરી અને તેથી રૂા. ૨૫૦ આસપાસના ભાવે એન્ટ્રી લઈ લેવાનો ચાન્સ ન છોડા.
- ચાઈટીસી**, ગયા અંક વખતે પણ ભાર પૂર્વક ભેગા કરવાનું કહ્યું હતું. ૧લી ફેબ્રુઆરીથી સિગારેટ ઉપર અલગ અલગ ડ્યુટી વધવાની અને તે પાછળ ગભરાટમાં રૂા. ૩૧૮ સુધી આવી ગયો. ઈન્ટરોમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ભાવે થોડાક શેરો લઈને મૂકી દેજો. સુંદર બાઉન્સ બેક સાથે ૪૦ ટકા રિટર્નની થોડા મહિનામાં સંભાવના.
- એશિયન પેર્ફેન્ડ્સ**, બિરલા ઓપસની હરિફાઈની વાત પાછળ છેલ્લા ઘણા મહિનાથી નબળાઈ દર્શાવે છે. રૂા. ૨૪૩રના ભાવે શેર આકર્ષક, અને ઉપરમાં ૪૦ ટકા રિટર્નની જગ્યા. મધ્યમગાળાના ઈન્વેસ્ટમેન્ટની રીતે પકડી શકાય.
- ઈન્ડેક્સ**, વૈશ્વિક અનિશ્ચિતતા અને ભારતીય શેરબજારમાંથી એફઆઈઆઈની સતત વેચવાલી અને રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણ થવાને કારણે અર્થતંત્રની પરિસ્થિતિ નાજૂક અને તે પાછળ નિફ્ટીના હેવીવેઈટ શેરોમાં સતત વેચવાલીનો માહોલ. ગડયાગાંઠ્યા પસંદગીના શેરોમાં જ અત્યારે કામ કરવામાં પૈસા મળે તેવી હાલત.

ડોલરનો વ્યાપાર થઈ રહ્યો છે. ભારતમાંથી લગભગ ૭૬ બિલિયન ડોલરનો માલ યુરોપિયન યુનિયનમાં જાય છે અને ભારત દ્વારા ૬૧થી ૬૫ બિલિયન ડોલરની આયાત કરવામાં આવે ચે. ભારતની કુલ નિકાસોમાં યુરોપિયન યુનિયનનો હિસ્સો ૧૭ ટકા છે. જ્યારે યુરોપમાં જે આયાત થાય છે તેમાં ભારતના માલનો હિસ્સો એક ટકા કરતા પણ ઓછો છે. આમ આ સમજૂતીને અત્યારના તબક્કે તો સરકારી વર્તુળો દ્વારા આવકારાઈ છે પરંતુ આપણે સૌએ જોયું કે મંગળવાર અને બુધવારના બજારમાં તેનો ખાસ કોઈ પ્રતિભાવ નથી પડ્યો અને વિવિધ ગ્લોબલ બ્રોકરેજ હાઉસ પણ આ સમજૂતી અંગે અલગ અલગ મંતવ્યો દર્શાવી રહ્યા છે અને તેમાં ગોલડમેન સેચનું મંતવ્ય ખાસ રસપ્રદ છે. ગોલડમેન સેચના મંતવ્ય મુજબ યુરોપિયન યુનિયન દ્વારા ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ ઉપર સરેરાશ ત્રણથી ચાર ટકા જેટલી નીચી ટેરિફ લાગડવામાં આવતી હતી અને તેને



અને યુરોપિયન યુનિયન વ્યાપાર ધર્ષણના તબક્કામાં ફસાયેલા છે અને તેવા તબક્કે વૈશ્વિક જીડીપીના લગભગ ૨૫ ટકા હિસ્સો ધરાવતા આ બંને અર્થતંત્ર વચ્ચે સમજૂતી થાય તે રાજકીય મહત્વ ધરાવે છે.

અમેરિકા દ્વારા યુરોપના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ૨૫ ટકા ટેરિફ ઝીંકી દેવામાં આવી હતી પરંતુ તે પછી ઘટાડીને ૧૫ ટકા કરાઈ છે. સામે પક્ષે ભારતમાંથી નિકાસ થતી અને અમેરિકામાં આયાત થતી પ્રોડક્ટો ઉપર ૫૦ ટકાની જુટ્ટી છે અને તેથી વિશ્વભરના દેશોએ અમેરિકા સિવાયના અન્ય દેશો સાથે સંબંધો વધારવાનું શરૂ કર્યું છે અને તેના સંદર્ભમાં આ સમજૂતી મહત્વ ધરાવે છે. અને એક અંદાજ મુજબ યુરોપિયન યુનિયનની ભારત ખાતેની અત્યારની નિકાસોની સરખામણીમાં સને ૨૦૩૨ સુધીમાં ૧૦૦ ટકાનો વધારો હાંસલ થવાની ગણતરી છે અને મૂલ્યની દૃષ્ટિએ લગભગ ૯૬.૬૦ ટકા માલ ઉપરની જુટ્ટી થટી છે. ભારતીય વડાપ્રધાન દ્વારા આ સમજૂતીને મધર ઓફ ઓલ ટ્રેડ તરીકે દર્શાવવામાં આવી છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે અત્યારના તબક્કે ૧૪૦ બિલિયન

કારણે ટેરિફમાં સમજૂતીને કારણે જે ઘટાડો થયો છે તેનાથી ભારતમાંથી નિકાસ થતી ચીજોમાં મોટો ઉછાળો આવી જશે તે સંભાવના મર્યાદિત છે અને જ્યારે સમજૂતીને સંપૂર્ણપણે અમલમાં મૂકાય તો પણ યુરોપિયન યુનિયનના જીડીપી ઉપર તેની ૦.૧ ટકા કરતા પણ ઓછી અસર છે. તેમ છતાં મોર્ગન સ્ટેનલીના મંતવ્ય મુજબ યુરોપિયન યુનિયન દ્વારા ૧૨૫ બિલિયન ડોલરના ટેક્સટાઈલ અને

સમજૂતી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ લેટેસ્ટ સંકેત મુજબ વર્કિંગ લેવેલ ઉપર આ સમજૂતીનું માળખું તૈયાર થઈ રહ્યું છે અને હવે એકાદ અઠવાડિયામાં રાજકીય લેવેલે તેને મહોર લાગી જાય તે પછી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે સમજૂતી જાહેર થઈ જશે. આમ આવતા અઠવાડિયે એક તરફ બજેટની પોઝિટિવ જોગવાઈ અને બીજી તરફ અમેરિકા અને ભારત વચ્ચેની વ્યાપાર સમજૂતીની જાહેરાત આ બે મહત્વના તેજના ટ્રીગર બની રહે તે સંભાવના મજબૂત છે.

ટેકનિકલ દૃષ્ટિકોણથી જોઈએ તો પણ બજાર હવે સતત કરેક્શન પછી ટ્રેન્ડ રિવર્સલ અને બાઉન્સબેકની નજીક આવી ગયું છે અને તેથી હવેના તબક્કે શોર્ટટર્મ ખેલાડીઓ પોતાની ટ્રેડિંગ પોઝિશન ખૂબ જ સમજપૂર્વક બનાવવી ખૂબ જરૂરી છે.

ત્રીજા ક્વાર્ટર દરમ્યાન ભારતના સિમેન્ટ સેક્ટરની માંગ એકંદરે ઠંડી રહી હતી. ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમ્યાન આગલા ક્વાર્ટરની સરખામણીમાં તદ્દન સામાન્ય વૃદ્ધિદર જોવાયો. ઓક્ટોબરમાં ૫.૩ ટકા વોલ્યુમ વૃદ્ધિ સાથે ૩૭૭ લાખ ટન સિમેન્ટનું વેચાણ થયું હતું જે પ્રથમ સાત મહિના દરમ્યાન કુલ ૭.૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અને પ્રથમ સાત મહિના દરમ્યાન ૨૬૬૭ લાખ ટન સિમેન્ટનું વેચાણ થયું છે.

સામે પક્ષે સિમેન્ટની કિંમતો ઉપરનું દબાણ સતત વધતું રહ્યું. અને લાંબા ચોમાસા પછી માંગમાં થોડો

વિલંબ પણ જોવાયો હતો. પરંતુ હવે ડિસેમ્બર મહિનાથી કન્સ્ટ્રક્શન સેક્ટરની માંગમાં ધીમો સુધારો શરૂ થયો છે. આ ઉપરાંત સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અને ગ્રામ્ય હાઉસિંગ અંગેના પગલાઓને કારણે એકંદરે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમ્યાન માંગમાં ૪.૫૦ ટકાનો વૃદ્ધિદર હાંસલ થયો છે. માંગમાં આ જે સુધારો છે તેનો મહત્તમ ફાયદો અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપનીઓને મળવાની ગણતરી છે. સને ૨૦૨૫-૨૬ના આખા વર્ષ માટે સિમેન્ટની માંગ લગભગ ૬.૫થી ૭.૫ ટકા વધીને ૪૮૪૦ લાખ ટન થવાનું અંદાજ છે. અને તેમાં મુખ્યત્વે સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગલક્ષી પ્રોજેક્ટોનો ફાયદો મળી શકશે. તેમ છતાં શ્રી દેવન ચોકસીના મંતવ્ય મુજબ એકંદરે સામાન્ય વૃદ્ધિદરને કારણે અને સિમેન્ટની કિંમતો ઉપરના સતત દબાણને કારણે કંપનીઓના પરિણામો અંગે આશાવાદ નહિયત છે. સિમેન્ટ ઉદ્યોગ માટેનું લાંબાગાળાનું ભાવિ ખૂબ જ મજબૂત છે પરંતુ શોર્ટટર્મમાં ઉછાળાની સંભાવના મર્યાદિત હોવાનું શ્રી દેવન ચોકસી દર્શાવી રહ્યા છે.

કંપનીટીહ અભ્યાસ કરીએ તો રૂા. ૧૨૬૧૪ ઉપરના **અલ્ટ્રાટેક સિમેન્ટ**માં મજબૂત અપટ્રેન્ડ શરૂ થયો છે. શેર અત્યારે ૪૭.૯૦ના પીઈરશિયો ઉપર મળી રહ્યો છે અને આ કાઉન્ટર ઉપરના વોલ્યુમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોઈ શકાય છે. ગયા અઠવાડિયે પણ આ શેરે ૩.૨૬ ટકાનો ઉછાળો દર્શાવ્યો

<div>DYNAMIC INDUSTRIES LIMITED</div> <div>CIN : L24110GJ1989PLC01989</div> <div>Regd Office :Plot No. 5501/2, Phase III, Nr. Trikampura Cross Road, G.I.D.C., Vatva, Ahmedabad - 382 445</div> <div>Tel : 25897221-22-23, Fax: 25834292</div> <div>Email : accounts@dynamind.com Website : www.dynamind.com</div> <div>Statement of Unaudited Financial Result for the Quarter and Nine Months ended on 31st December, 2025</div> <div>(Rs. In Lakhs except earning per share)</div>									
Sr. No	PARTICULARS	Quarter Ended 31/12/2025 (Unaudited)	Quarter Ended 30/09/2025 (Unaudited)	Quarter Ended 31/12/2024 (Unaudited)	Nine Months ended 31/12/2025 31/12/2024		Year Ended 31/03/2025 (Audited)		
					31/12/2025 (Unaudited)	31/12/2024 (Unaudited)			
I	Income:								
(a)	Revenue From Operations	1410.11	1787.50	1,444.35	5425.58	5367.18	7265.30		
(b)	Other Income	2.86	21.80	10.42	26.78	29.97	40.66		
II	Total Income(a+b)	1412.97	1809.30	1454.77	5452.36	5397.15	7305.96		
III	Expenses:								
(a)	Cost of materials consumed	1074.46	1132.56	1113.43	3685.32	3944.95	5099.53		
(b)	Purchase of Stock in Trade	15.89	49.24	51.27	205.62	293.57	407.65		
(c)	Changes in inventories of finished goods, work in progress and stock in -trade	(84.60)	122.28	(147.90)	72.45	(241.89)	(70.48)		
(d)	Employees benefits expenses	91.71	91.75	94.76	275.53	278.10	365.20		
(e)	Finance costs	29.25	36.98	39.92	99.82	113.95	153.35		
(f)	Depreciation and amortisation expenses	53.05	52.69	51.98	157.63	151.24	202.32		
(g)	Other expenses	224.94	270.45	241.32	785.72	720.63	944.24		
IV	Total Expenses	1404.70	1755.95	1444.78	5282.09	5260.55	7101.81		
V	Profit before exceptional items and tax(II-IV)	8.27	53.35	9.99	170.27	136.60	204.15		
(a)	Exceptional Items	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
VI	Profit before tax (V-VI)	8.27	53.35	9.99	170.27	136.60	204.15		
VII	Tax Expenses:								
VIII	Current Tax	(5.23)	14.25	0.00	53.77	8.99	8.99		
(a)	Deferred Tax	8.10	3.01	10.11	(3.90)	35.61	36.59		
(b)	Tax in respect of earlier years	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
(c)	Total Tax Expenses	2.87	17.26	10.11	49.87	44.60	45.58		
IX	(Loss) / Profit for the Period from Continuing operations (VII-VIII)	5.40	36.09	(0.12)	120.40	92.00	158.57		
X	(Loss) / Profit for the Period from Discontinuing operations	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
XI	Tax expenses of Discontinuing operations (Loss) / Profit for the Period from discontinuing operations (after tax) (X-XI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
XII	(Loss) / Profit for the Period (IX-XII)	5.40	36.09	(0.12)	120.40	92.00	158.57		
XIII	(Loss) / Profit for the Period (IX-XII)	5.40	36.09	(0.12)	120.40	92.00	158.57		
XIV	Other Comprehensive Income / (Loss)								
(a)	Items that will not be reclassified to Profit or Loss (Net of Tax)	31.45	(0.35)	(0.31)	31.71	0.47	1.10		
(b)	Items that will be reclassified to Profit or Loss (Net of tax)	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
XV	Total Comprehensive income / (Loss) for the period (XIII+XIV) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	36.85	35.74	(0.43)	152.11	92.47	159.67		
XVI	Paid-up equity share capital (face value of Rs.10)	302.85	302.85	302.85	302.85	302.85	302.85		
XVII	Reserves/Other Equity								
XVIII	Earning per equity Shares(For Continuing Operation) (of Rs 10 each) (not annualised)	0.18	1.19	-0.00	3.98	3.04	5.24		
(a)	Basic	0.18	1.19	-0.00	3.98	3.04	5.24		
(b)	Diluted	0.18	1.19	-0.00	3.98	3.04	5.24		
XIX	Earning per equity Shares(For Discontinuing Operation) (of Rs 10 each) (not annualised)								
(a)	Basic	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
(b)	Diluted	0.00	0.00	0.00	0.00	0.00	0.00		
XX	Earning per equity Shares (of Rs 10 each) (not annualised)								
(a)	Basic	0.18	1.19	-0.00	3.98	3.04	5.24		
(b)	Diluted	0.18	1.19	-0.00	3.98	3.04	5.24		
Notes: 1.The financial results of the company for the quarter and nine months ended on 31st December, 2025 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their meeting held on 3rd February, 2026. The limited review as required under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended has been completed by the statutory auditors of the Company. 2.These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules 2015 and relevant amendments thereafter. 3.The Company operates in a single segment and in line with Ind AS - 108 - "Operating Segments", the operations of the Company fall under "Dyes and Chemicals" which is considered to be the only reportable business segment. 4.On November 21, 2025, the Government of India notified four Labour Codes – the Code on Wages, 2019, the Industrial Relations Code, 2020, the Code on Social Security, 2020, and the Occupational Safety, Health and Working Conditions Code, 2020 (collectively referred to as the New Labour Codes) – consolidating 29 existing labour laws, which became effective immediately. Following the implementation of the New Labour Codes, the Company has recognized a provision for defined benefit obligations in its financial results for the quarter ended December 31, 2025, based on management's assessment and estimates of liabilities. The Company continues to closely monitor the finalization of Central and State Rules, as well as clarifications to be issued by the Government on various aspects of the New Labour Codes. Any additional accounting impact, if required, will be reflected in subsequent financial results in line with such developments. 5. The Company does not have any subsidiary company including an associate and joint venture. Accordingly, preparation of consolidated financial results is not applicable.									
<div>For and on behalf of Board of Directors, Dynamic Industries Limited</div> <div>Sd/-</div> <div>Neeraj Shah</div> <div>Managing Director</div> <div>DIN: 0005112261</div>									
Date : 3rd February, 2026 Place : Ahmedabad									

